



ગુજરાત સરકાર ખેડૂત મિત્ર

# અનુક્રમણિકા

- પ્રસ્તાવના
- આ એપની વિશિષ્ટતા શું છે?
- આ એપની સુવિધાઓ કે જેનો ઉપયોગ ગુજરાત ના ૪૫૦૦૦ ખેડૂતો આજે કરી રહ્યા છે.
- સરકારી સંદેશાઓની સુવિધા એટલે શું?
- મીડિયા ગેલેરીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
- ઉપયોગી વેબસાઈટ તથા એપ્લિકેશન ની લિંક એટલે ?
- ખાસ ઉપયોગી વિશેષતાઓ
- શું માર્કેટિંગ યાર્ડ ના ભાવ પણ જાણી શકાય ?
- ક્યા કામ માટે કઈ સરકારી કચેરીમાં ક્યા અધિકારીને ક્યાં સંપર્ક કરવો ?
- ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ તથા એગ્રો ડીલરો ક્યાં-ક્યાં અને કેટલા ?
- ખેત ઉપયોગી ઉત્પાદનો ક્યા-ક્યા અને તેની ઉપયોગીતા શું ?
- હવામાન / માહિતી / સમાચાર / લેખ
- આ એપ થકી સરકાર ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે.

# પ્રસ્તાવના



ગુજરાત સરકાર ના કાર્યો માંથી પ્રેરણા લઈને ગુજરાતના ખેડૂતના વિકાસ માટે આ મોબાઈલ એપ લોન્ચ કરેલ છે.

આજ સુધી સરકાર ખેડૂતો સુધી પોતાની વાત કે યોજનાઓની માહિતી પહોંચાડવા સમાચાર પત્રો, રેડીયો, ટેલિવિઝન, પોસ્ટર જેવા માધ્યમોનો ઉપયોગ કરતી આવી છે જેમાં ચોક્કસપણે નથી કહી શકાતું કે આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચી રહી છે કે કેમ. પરંતુ આ એપના વપરાશકર્તા ખેડૂતો જ હોવાથી દરેક માહિતી સચોટ રીતે નિર્ધારિત ખેડૂતો સુધી પહોંચી શકશે અને ખેડૂતોને સરકારની દરેક યોજનાઓ તેમ જ સમાચાર થી ત્વરિતપણે માહિતગાર તેમજ લાભાન્વિત કરી શકાશે.

તદુપરાંત આ એપ ખેડૂતો માટે સંપૂર્ણતઃ મફત છે, ખેડૂતો માટે આ એપ વાપરવાનો કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી.

# આ એપની વિશિષ્ટતા શું છે?

ભારતનો સીમાંત ખેડૂત નીચી સાક્ષરતા ધરાવે છે જેથી અન્ય ભાષામાં એમની નિરક્ષરતા ની મર્યાદા નડે છે જેથી તેઓને અમુક બાબતો સમજવી અઘરી પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ મોબાઈલ એપ્લીકેશન સંપૂર્ણ ગુજરાતીમાં બનાવામાં આવેલ છે જેથી કરીને એક સામાન્ય ખેડૂત આને સરળતાપૂર્વક સમજીને વાપરી શકે.

જો કોઈ માહિતી કોઈ ચોક્કસ વિસ્તાર, તાલુકા, જિલ્લા કે ચોક્કસ વર્ગના ખેડૂતોને જ સ્પર્શતી હોય તો પણ સમાચાર પત્રો કે ટેલિવિઝન ના માધ્યમથી આપવી પડે છે જે બાબતે ચોક્કસાઈપૂર્વક ના કહી શકાય કે તે માહિતી તે ચોક્કસ વર્ગને જ મળી કે કેમ. પરંતુ આ એપ ના માધ્યમ થી કોઈ ચોક્કસ વર્ગ ના ખેડૂતોને ને માહિતી મોકલવી શક્ય છે જે વધુ અસરકારક તેમ જ ઓછી ખર્ચાળ છે.

આ એપની સુવિધાઓ કે જેનો ઉપયોગ ગુજરાત  
ના ૪૫૦૦૦ ખેડૂતો આજે કરી રહ્યા છે.



સરકારી સંદેશાઓ

મીડિયા ગેલેરી



સરકારી તથા અન્ય ઉપયોગી  
વેબસાઈટ તથા એપ

લાભાર્થીઓ માટેની સરકારી  
યોજનાઓની માહિતી

# સરકારી સંદેશાઓની સુવિધા એટલે શું?



સરકાર દ્વારા ખેડૂતના હિતમાં પ્રસારિત અને પ્રચારિત વિવિધ સંદેશાઓ, માહિતીઓ, નિયમો, કાયદાઓ વગેરે ખેડૂતો સુધી તાત્કાલિક અસરથી પહોંચી નથી શકતા. અમુક કિસ્સાઓમાં તો તેઓ આ બધી માહિતી થી તદ્દન અલિપ્ત જ રહી જતા હોય છે.

આવા કિસ્સાઓમાં ખેડૂતો અમુક લાભ ચુકી જાય છે કે કૈક ગુમાવી પણ બેસે છે. આ પરિસ્થિતિ નિવારવા ખેડૂતોના લાભ ને ધ્યાનમાં લઈને આ જરૂરી સંદેશાઓ એપ જોડે સંકળાયેલા દરેક ખેડૂત સુધી પહોંચે તેની પૂરતી કાળજી લેવામાં આવે છે.

આ દરેક સંદેશાઓ તેઓ અન્ય સંચાર માધ્યમો થકી આગળ તેમના અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકે એવી સુવિધા પણ આપવામાં આવે છે.

## મીડિયા ગેલેરીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?



સમાચાર પત્રો કે ટેલિવિઝન માં પ્રસારિત થતા ખેતીવિષયક કે અન્ય સમાચારો રોજરોજ જોવા, વાંચવા કે સાંભળવા જેટલો સમય ખેડૂતો ફાળવી શકતા હોતા નથી અને એવા જરૂરી સમાચારોથી આવા ખેડૂતો અજાણ રહી જાય છે.

આ બાબતને ધ્યાનમાં લઈને આ વિભાગમાં રોજરોજ ના મહત્વના સમાચારો પ્રસારિત કરવામાં આવે છે જેથી તેઓ એમને અનુકૂળ સમયે અને અનુકૂળ જગ્યાએથી આ સમાચારો સરળતાથી જાણી શકે છે.

# ઉપયોગી વેબસાઈટ તથા એપ્લિકેશન ની લિંક એટલે ?



કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તેમની કૃષિને લગતી નીતિઓ, યોજનાઓ/પરિયોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડી તેનો લાભ ખેડૂતોને આપવા કાર્યશીલ છે, અને આ બધી જ યોજનાકીય માહિતી સરકારની અલગ અલગ વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન માં જણાવેલી હોય છે.

યોજનાકીય લાભો મેળવવા માટેની અરજીઓ કે અમુક માહિતીઓ મેળવવા માટેના પોર્ટલ વગેરે થી મોટા ભાગના ખેડૂતો અજાણ હોય છે અથવાતો તેમને અલગ અલગ વેબસાઈટ કે એપ શોધવા માટે અલગ અલગ સ્ત્રોત શોધવા પડે છે, જેમાં તેમની ઉર્જા અને સમયનો વ્યય થાય છે.

આ એપમાં આ બધીજ વેબસાઈટ તથા એપની માહિતી તેમજ તેની ઉપયોગીતા એક જ જગ્યાએ મુકવામાં આવી છે જેથી કરીને ખેડૂત ને આ બધી જ માહિતી એક જ સ્ક્રીન પર મળી રહે અને તેમની ઉર્જા અને સમયનો નો બચાવ થાય.



# ખાસ ઉપયોગી વિશેષતાઓ

આ એપની માહિતી આ એપના વપરાશકર્તાઓ સુધીજ સીમિત નહિ રાખતા અમે દરેક માહિતી સાથે એક "શેર (Share)" બટન આપેલ છે જેના થકી ખેડૂતો તેમના અન્ય મિત્રવર્તુળમાં આ માહિતી Facebook, E-Mail, Whatsapp, SMS વગેરે જેવા પ્લેટફોર્મ થકી શેર કરી શકે છે.

આ એપમાં ખેડૂતો એમના સૂચનો તેમજ વધુ કોઈ સુવિધાનો સમાવેશ કરવા કરવા માટે ની અરજી મૂકી શકે તેવી સુવિધા (Feedback) પણ મુકવામાં આવેલ છે, આમ આ એપને વધુને વધુ સંવાદાત્મક બનાવી તેની ઉપયોગીતા વધારવાના દરેક પગલાં લેવા અમે તત્પર છીએ.

આ સુવિધાઓ ઉપરાંત ખેડૂતોના ફીડબેક અને સૂચનોના આધારે ખુબ અગત્યની સુવિધાઓ ઉમેરેલ છે જેની છણાવટ હવે આગળના પ્રેઝન્ટેશનમાં પ્રસ્તુત છે.

# શું માર્કેટિંગ યાર્ડ ના ભાવ પણ જાણી શકાય ?



ખેડૂતો પાક લાણ્યા પછી તેનું યોગ્ય મૂલ્ય મળે તે માટે પ્રયત્નશીલ હોય છે. દરેક માર્કેટિંગ યાર્ડ માં અલગ અલગ ભાવે હરાજી થતી હોય છે જેથી ગુજરાતના ૩૦૦ થી વધુ માર્કેટિંગ યાર્ડ માં ક્યાં કેટલો ભાવ મળી રહેશે તેની રોજરોજની માહિતી મેળવવી એક સામાન્ય ખેડૂત માટે અઘરી બની જાય છે.

સરવાળે ખેડૂત નજીકના માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ મળે ત્યાં પાક વેચી દેવા મજબૂર બને છે અને ઘણીવાર તેમને પાકનું સાચું મૂલ્ય નથી મળી શકતું.

આ સમસ્યાનું નિવારણ લાવવા અમે દૈનિક માર્કેટિંગ યાર્ડના ભાવો જાણી શકાય તેવી સુવિધા ખેડૂતને આંગળીના ટેરવે આપવા જઈ રહ્યા છીએ. ખેડૂત તેમનો પાક જણાવે એટલે તરત જ તાજેતરનો સૌથી વધુ ભાવ જે માર્કેટિંગ યાર્ડ માં છે તેનાથી માંડીને ઉતારતા ક્રમમાં માર્કેટિંગ યાર્ડ નું નામ અને ભાવનું લિસ્ટ બતાશે જેથી ખેડૂત નક્કી કરી શકશે કે તેને પાક વેચવા ક્યાં જવું.

# ક્યા કામ માટે કઈ સરકારી કચેરીમાં ક્યા અધિકારીને ક્યા સંપર્ક કરવો ?



સત્યમેવ જયતે

સામાન્યતઃ ખેડૂતો ને જ્યારે કોઈ સરકારી મદદ ની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે તેઓ કઈ સમસ્યા માટે ક્યા સરકારી વિભાગ કે અધિકારીને ક્યાં અને કેવી રીતે સંપર્ક કરવો તે બાબતે મૂઝવાણુ અનુભવતા હોય છે અને સરવાળે ખોટી જગ્યાએ ખોટી વ્યક્તિનો સંપર્ક કરીને તેમને હેરાનગતિ વેઠવી પડે છે. તેમની આ સમસ્યાના નિવારણ હેતુ ખેડૂતોને તેમના જિલ્લા, તાલુકા અને ગામ માં આવેલી સરકારી કચેરીઓ તથા અધિકારીઓ ના સરનામાં, કોન્ટેક્ટ નંબર અને તેમનું કાર્ય સમજાવતી માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી તેઓ આ સરકારી કચેરીઓ તેમજ અધિકારીઓ જોડે સાનુકૂળ રીતે સંપર્કમાં રહી શકે.

# ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ તથા એગ્રો ડીલરો ક્યાં-ક્યાં અને કેટલા ?



ગુજરાતમાં ૩૦૦ થી વધુ માર્કેટિંગ યાર્ડ આવેલા છે તથા હજારો ની સંખ્યામાં ખેતીવિષયક ઉત્પાદનો વેંચતા વિક્રેતાઓ આવેલા છે. એક સામાન્ય ખેડૂતને અવારનવાર આ બંને ની જરૂર પડે છે પરંતુ તેઓ પાસે રહેલા વિકલ્પો વિષે તેઓ અજાણ હોય છે. આમ સ્પર્ધાત્મક બજાર માં વૈકલ્પિક વિક્રેતાઓ કે અન્ય માર્કેટિંગ યાર્ડ ની માહિતી ના હોવાથી ખેડૂત ઘણી અગવડતા અનુભવે છે.

આ બાબત ધ્યાનમાં રાખીને અમે ખેડૂતને જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આવેલા સરકારી એજન્સીઓ દ્વારા અધિકૃત તથા ખાનગી વિક્રેતાઓ ની તેમજ માર્કેટિંગ યાર્ડની બધીજ માહિતી જેવીકે સરનામું, અધિકૃત વ્યક્તિનું નામ, કોન્ટેક્ટ નંબર વગેરે પુરી પાડવા જઈ રહ્યા છીએ. ખેડૂત આ માહિતીને પોતાના જિલ્લા, તાલુકા કે ગામ પૂરતી જ જોવા માંગે તો તેમ જોવું પણ શક્ય છે.

# ખેત ઉપયોગી ઉત્પાદનો ક્યા-ક્યા અને તેની ઉપયોગીતા શું ?



આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ માં રોજ કૈક ને કૈક નવા શોધ શંશોધનોને આધારે નવી પદ્ધતિ, સુવિધાઓ તેમજ ગુણધર્મો ધરાવતા ઉત્પાદનો બજારમાં આવે છે અને આ પૈકી કૃષિને ઉપયોગી થાય તેવા પણ ઘણા ઉત્પાદનો પણ જોવા મળે છે. આ બધા જ ઉત્પાદનો એક યા બીજી રીતે ખેડૂતને વધતા ઓછા અંશે ઉપયોગી થઈ શકતા હોય છે. પરંતુ પૂરતી સમજણ અને સજાગતા ના અભાવે ખેડૂતો આ ઉત્પાદનોનો લાભ નથી લઈ શકતા. અમુક કિસ્સાઓમાં ઉત્પાદનો ખેડૂતની નજર સામે હોવા છતાં તેઓ તેની ઉપયોગીતા અને વપરાશની પદ્ધતિની સમજણના અભાવે તેમાંથી પૂરતો લાભ નથી લઈ શકતા. આ બાબત ધ્યાનમાં લઈને અમે સરકારી તેમજ ખાનગી એકમો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો ની માહિતી આ વિભાગમાં મુકવા જઈ રહ્યા છે જેમાં ઉત્પાદન અને તેમાં વપરાયેલ સામગ્રીઓ, તેની ઉપયોગીતા, વપરાશની રીત, વપરાશનો જથ્થો આ બધી જ બાબતો સરળ ભાષામાં આવરી લેવામાં આવી છે.

સૌ પ્રથમ વખત “મોબાઈલ દ્વારા ખરીદ વેચાણ” ની સુવિધાઓ ઉમેરવામાં આવેલ છે જેની છણાવટ હવે આગળના પ્રેઝન્ટેશનમાં પ્રસ્તુત છે.



## સૌ પ્રથમ વખત વધુ સરળ સુવિધાઓ સાથે "ગુજરાત સરકાર ખેડૂત મિત્ર"

- ખેત ઉત્પાદન ખરીદવા / વહેચવા
- ખેત ઓજારો-મશીનરી ખરીદવા / વહેંચવા
- ખાતર ખરીદવા / વહેચવા
- બિજ - બિયારણ ખરીદવા / વહેંચવા
- જંતુનાશક દવાઓ ખરીદવા / વહેચવા

ખેડૂતો તથા ડીલરો માટે ઉપરોક્ત સુવિધાઓ ની વધુ માહિતી તથા ઉપયોગીતાઓ માટે નિયમિત એપ્લીકેશન જોતા રહો તથા અન્ય મિત્રો ને પણ જણાવો.

આ સગવડતા શરુ થઈ ગયેલ છે.



# "મોબાઈલ દ્વારા ખરીદ વેચાણ ની ઉપયોગીતા શું ?

"મોબાઈલ દ્વારા ખરીદ વેચાણ ની સુવિધાઓમાં ખેડૂત કે ડીલર પોતાના તૈયાર ખેત ઉત્પાદન, જરૂરિયાત મુજબ ના બિયારણ કે રોપાઓ, જંતુનાશક દવાઓ, દેશી અને વિલાયતી ખાતર તથા વાપરેલા કે નવા ખેતી ના ઓજારો, મશીનરી ની ખરીદી કે વેચાણ પોતાના વિસ્તાર પૂરતા માર્યાદિત નહિ પરંતુ જિલ્લા કે રાજ્ય ના બધા જ એરિયા માટે દર્શાવી શકે છે. માલ ની ખરીદી કે વેચાણ સીધા વપરાશકર્તા ના હાથ માં જતું હોવાથી યોગ્ય કિંમત મળી રહેશે. ખેડૂતો કે ડીલરોએ મુકેલ વિગત નું દરેક રજીસ્ટર થયેલ (50000) ખેડૂતો ને નોટિફિકેશન જતું હોવાથી સોદો ધાર્યા પ્રમાણે અને સમયસર થશે.

અત્યાર સુધી ખેડૂતોને ખરીદી કે વેચાણ માટે નજીકના શહેર સુધી આવવું પડતું હતું જે હવે ફક્ત મોબાઈલ માં વિગત ભરી ને કરી શકશે જેનાથી ખેડૂતો ને ઉર્જા અને સમય બંને નો બચાવ થશે.

# હવામાન / માહિતી / સમાચાર / લેખ



ભારત કૃષિપ્રધાન દેશ છે અને કૃષિમાં સૌથી મહત્વનું પરિબલ છે વરસાદ. વરસાદ ની અનિયમિતતા એ ખેડૂતને સૌથી વધુ પજવતી મુશ્કેલી છે. કુદરત સામે લડી તો ના શકાય પરંતુ તેને અનુકૂળ થઈને લીધેલા નિર્ણયો ચોક્કસપણે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે હવામાન ની આગાહી તેમજ સમાચારો ની સુવિધા આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને ખેડૂતો તેમના ખેતી વિષયક નિર્ણયોમાં આ માહિતી પણ ઉપયોગમાં લઈને થતું નુકસાન વધતા ઓછા અંશે અટકાવી શકે.

આ ઉપરાંત ખેતી વિશેષજ્ઞો દ્વારા લખાયેલા જ્ઞાનવર્ધક લેખો તેમજ સંશોધનોની માહિતી પણ અહીં ઉપલબ્ધ થશે જે ખેડૂત સમજી શકે એમ સરળ અને સુગમ રીતે રજૂ કરવામાં આવશે.

# આ એપ થકી સરકાર ખેડૂતોને આ રીતે મદદરૂપ થઈ શકે છે



આ એપ થકી સરકાર ખેડૂતોના સીધા સંપર્કમાં રહી જરૂરી માહિતીનું આદાન-પ્રદાન કરી શકશે. આમ ખેડૂત સતત સરકાર સાથે અને સરકાર ખેડૂતો સાથે જોડાઈ રહેશે અને કૃષિ કલ્યાણની યોજનાઓ સફળ બનાવી શકાશે.

જે ખેડૂત આજે પછાતપાણામાં અને આધુનિકરણ થી દૂર જીવી રહ્યો છે તે હવે આ એપ થકી ડિજિટલ વર્લ્ડ જોડે સંકળાશે અને ટેકનોલોજી થી પરિચિત થશે. આમ તે ડિજિટલ વ્યવહારો સમજશે અને કરતા શીખશે જે સરકાર ના ડિજિટલ ભારત ના સ્વપ્ન તરફ ખેડૂતોને એક નવી રાહ ચીંધશે.

# આ એપ થકી સરકાર ખેડૂતોને આ રીતે મદદરૂપ થઈ શકે છે



ખેડૂતો ને બિયારણ, ખેતીના પોષણ, ખેતીને લગતી સમસ્યાઓના નિવારણ તેમજ દરેક ખેતી આધારિત મુદ્દાઓને સ્પર્શતી માહિતી આંગળીના ટેરવે મળશે જેથી કરીને ખેડૂતો વધુ આત્મવિશ્વાસ કેળવશે અને સરવાળે પાકમાં વૃદ્ધિ થશે જે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે.

સરકારના કૃષિનું નિયમન કરતા બધા જ વિભાગો, કૃષિ યુનિવર્સિટીઓ, ખેતી વિશેષજ્ઞો તેમજ ખેડૂતોને એક તાંતણે જોડતી કડી નું કામ કરતી આ એપ આ બધા વચ્ચે સંકલન સાધશે અને સર્વાંગી વિકાસ માં ફાળો આપશે.